(₹ in Lakhs)

Quarter

ended

30.06.2022

(Unaudited)

6,134

263

193

169

CIN: L31400GJ1972PLC002091

Regd.Office: G.I.D.C. Makarpura, Vadodara - 390010

Phone: (0265) 2642661

 $\textbf{Website}: www.panasonicenergyindia.in \ \hat{\textbf{I}} \ \textbf{Email:} company.secretary@in.panasonic.com$

Extract of Unaudited Financial Results

for the quarter ended June 30, 2023

Quarter

ended

30.06.2023

(Unaudited)

7,748

259

243

750

1) The above financial results for the quarter ended 30 June 2023 were reviewed and recommended by the

The operations of the Company are limited to one segment, mainly, Dry Batteries.
 The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with Stock exchange under

www.bseindia.com and on the company's website www.panasonicenergyindia.in

Particulars

(before Tax, Exceptional and/or Extraordinary items

Net Profit/(Loss) for the period before tax

Net Profit/(Loss) for the period after tax

(after Exceptional and/or Extraordinary items

(after Exceptional and/or Extraordinary items)

Total Comprehensive Income for the period

[comprising Profit/(Loss) for the period (after tax)

Exchange's Website at www.bseindia.com and www.nseindia.com.

and Other Comprehensive Income (after tax)]

VIII Earning Per equity Share (FV Γ 10/- Per share)

Audit Committee and thereafter approved by the Board of Directors at their respective meetings held on 13

Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full

format of the Quarterly Financial Results are available on the Stock Exchange website namely

The Only battery Company in India Manufacturing 100% Eco-friendly Batteries

CHEMCON Email: investor.relations@cscpl.com | Website: www.cscpl.com | Tel: +91 265 2981195 | CIN: L24231GJ1988PLC011652

EXTRACT OF STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2023

* EPS as presented above is not annualised except for the year ended March 31, 2023.

1. The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchange under

Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full

format of the Financial Results are available on the Company's website at www.cscpl.com and the Stock

Chemcon Speciality Chemicals Limited

(An ISO 9001:2015 and ISO 14001:2015 Certified Company)

Jnaudited)

8,291.43

800.25

800.25

590.83

583.81

3,663.07

By order of the Board

DIN: 00139199

Nivida-22/23 Tender Notice

Tender Notice (1) Tender ID 607023 - Miscellaneous civil works for renovation of A-3 Bungalow at Vidhyut Nagar Colony Vadodara

(2) Tender ID 606812 Works Advertised Tender for Erection, Dismantling and Maintenance of HT/LT and Transformer center For ALL SCHEME WORK UNDER BODELI (O&M) S/DN or Any S/Dn of BODELI O&M Division (3) Tender ID 606815 - Works Advertised

Tender for Erection, Dismantling and Maintenance of HT/LT and Transformer center For ALL SCHEME WORK UNDER PAVIJETPUR

(O&M) S/DN or Any S/Dn of BODELI O&M Division (4) Tender ID 606821 - Works Advertised Tender for Erection, Dismantling and

Quarter Ended

(Audited)

8 196 84

1.420.72

1,420.72

1.047.01

1.035.95

3,663.07

For Chemcon Speciality Chemicals Limited

Kamalkumar Rajendra Aggarwal

Chairman & Managing Director

Madhya Gujarat Vij Company Limited

O&M CIRCLE OFFICE, GOTRI ROAD, BARODA-390 021 Tel: 2355520/21 Fax 2313164 barodaom@gebmail.com- E&P Dept-GoG: http://quj-epd.gov.in CIN U40102GJ2003SGC042907

30-06-2023 31-03-2023 30-06-2022 31-03-2023

Regd. Office: Block Number 355, Manjusar Kunpad Road, Manjusar Village, Taluka Savli, Vadodara 391775, Gujarat

Year to date ended

31.03.2023

(Audited)

25,701

(617)

(1064)

(1123)

750

For Panasonic Energy India Co. Ltd

Akinori Isomura

Chairman & Managing Director

Year Ended

7,415.14

7,415.14

5,511.01

5,482.92

3,663.0

42,072.84

(Unaudited) (Audited)

3.414.49

3,414.49

2.545.7

2.543.70

3,663.07

9,209.32 31,619.94

Particulars

before tax

after tax

Total income from operations (net)

Net Profit / (Loss) from ordinary activities

Net Profit / (Loss) from ordinary activities

Total Comprehensive Income for the period

(comprising profit and other compre

income for the period net of tax)

Paid up Equity Share capital

Earnings per share

(Basic and Diluted)

Place: Pithampur

Date: 11th August, 2023

Total income from operations

VI Equity Share Capital

basic & Diluted (in Γ)*

VII Other Equity

Place: Vadodara

Date : August 11, 2023

Notes:

Net Profit/(Loss) for the period

(Face Value of Rs.10/- each)

(Face Value of INR 10/- each)

ની મદદ લીધી હતી.અને જીપીસીબી દ્વારા કેમિકલ વેસ્ટના નમુના

લઈને પૃથકરણ માટે મોકલી આપી જરૂરી તપાસ શરૂ કરી હતી.

જ્યારે એફ એસ સેલ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Madhya Gujarat Vij Company Ltd.

O&M) Circle Office, 3rd Floor, Nagar PalikaBhavan, NADIAD-387001 Ph. No. (0268) 2562204 / 2562208 Fax No. (0268) 256229

Tender Notice No: 36/23

Tenders are invited vide 1). Tender ID No. 607426 for Providing China Mosaic, Colou

Work, Vitrified Tiles & Misc, Civil Work at Thasra Sub-Division under Nadiad O&N

The details are put up on https://www.nprocure.com (for on line submission, view and

હ્રત્વાદક સંઘ લિ. હ્યુંઓ

બરોડા ડેરી, વડોદરા-૩૯૦૦૦૯

ક્રક મી વાર્ષિક સાધારણ સભાની સુચના

આથી વકોદરા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., બરોડા ડેરી, વકોદરાન

સભાસદોને જણાવવાનું કે સંઘની કકમી વાર્ષિક સાધારણ સભા તા. ૨૬-૦૮-૨૦૨૩ ને

शनिपारना रोष सपारना १०.३० इसाडे **हाहा लगपान मंहिर, डेसनपुर**

મીટીંગમાં કરવાના કામ

ર. ગત તા. ૨૬-૦૭-૨૦૨૨ ના રોજ મળેલ કપમી વાર્ષિક સાધારણ સભાનું

3. સને ૨૦૨૨-૨૩ ના વર્ષ દરમ્યાન અંદાજ પત્રમાં દર્શાવેલ જોગવાઈઓ સામે

સને ૨૦૨૨-૨૩ દરમ્યાન સંઘના નિયામક મંડળે કરેલ કામકાજનો અહેવાલ

તથા સદર વર્ષના વ્યાપાર અને નફા-નુકશાન ખાતુ તથા તા. ૩૧-૩-૨૦૨૩

સંઘના નિયામક મંડળે મંજુર કરેલ તા. ૩૧-૦૩-૨૦૨૩ ના રોજ પૂરા થતા

સ્પે. ઓડીટરશ્રી, સહકારી મંડળીઓ(દૂધ), વડોદરા તરફથી આવેલ સને

૨૦૨૨-૨૦૨૩ ની સાલના હિસાબોનો ઓડીટમેમો તથા તેના દોષ-દૂરસ્તી

નિયામક મંડળના આદેશથી

અજચકુમાર એ. જોષી

મેનેજીંગ ડીરેક્ટર

ચાલુ નાણાંકીય વર્ષ સને ૨૦૨૩-૨૪ નું સંઘનું બજેટ મંજુર કરવા બાબત.

વર્ષના સરવૈયા મુજબ નફાની વહેંચણી મંજુર કરવા બાબત.

૧૦. વર્ષ ૨૦૨૩-૨૪ માટે સંઘના હિસાબી અન્વેષકની નિમણૂંક બાબત.

૧૧. પ્રમુખશ્રી તરફથી અગર તેઓશ્રીની પરવાનગીથી અન્ય જે રજુ થાય તે.

ડભોઇ-વડોદરા રોડ ખાતે રાખવામાં આવી છે. તો તે પ્રસંગે પધારવા વિનંતી છે.

૧. દિવંગતોને શ્રધ્ધાંજલી આપવા બાબત.

પ્રોસીડીંગ બહાલ રાખવા બાબત.

થચેલ ખરેખર ખર્ચની નોંધ લેવા બાબત.

ના રોજનું સરવૈયુ સ્વીકારવા બાબત.

છ. કરજે લેવાના નાણાંની યત્તા નકકી કરવા બાબત.

રીપોર્ટની નોંધ લેવા બાબત.

૯. સંઘના પેટા કાયદામાં સુધારો કરવા બાબત.

html?compcode=91 (for download only). Be in touch with website till tender open.

દિપકબેન હિમાંસભાઇ ત્રિવેદી હતુ બદલીને દીપીકાબેન હિમાંશુભાઇ ત્રિવેદી રાખેલ છે. ૧७/બી, ઝવેરનગર સોસાયટી, હરણી વારસીચા રીંગ રોડ, વડોદરા.

भा३ नाभ શેખ મોહમ્મદ તનવીર અબ્દ્લરસીદ થી બદલીને શેખ મોહમ્મદ તનવીર અબ્દ્લરસીદ કરેલ છે. ૧૧૯૯ . મોરાફૂવા પોલીસ સ્ટેશન પાસે,પાદરા, વડોદરા

7 મુંજાલ ઓટો ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ

રજી. ઓફ્રીસ :– ૧૮७, જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીચલ એસ્ટેટ, વાઘોડીયા. જી. વડોદરા.–૩૯૧ ७૬૦, ગુજરાત CIN: L34100GJ1985PLC007958 • ફોનઃ (૦૨૬૬૮) ૨૬૨૪૨૧–૨૨, ફેક્સ : (૦૨૬૬૮) ૨૬૨૪૨७

વિડીઓ કોન્ફરન્સિંગ (''વીસી'')/ અન્ય ઓડીયો વિઝ્યુઅલ માધ્યમો (''ઓએવીએમ'') દ્વારા આયોજિત, ૩૮મી વાર્ષિક સાધારણ સભા, ઇ-મતદાન માહિતી અને બુક-કલોઝર માટેની નોટીસ

અત્રે સચના આપવામાં આવે છે કે કંપનીઓ (વ્યવસ્થાપન અને વઠીવટ) નિયમો ૨૦૧૪ ના નિયમ ૨૦ અંતર્ગત કંપનીના શેરધારકોની ૩૮મી વાર્ષિક સાધારણ સભા ("એજીએમ") શનિવાર, ૦૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે મિટિંગની નોટિસમાં સમાવિષ્ટ વિષયો/મુદ્દાઓ પર કામકાજ કરવા માટે કોર્પોરેટ બાબતોના મંત્રાલય (''એમસીએ'') દ્વારા જારી સામાન્ય પરિપત્ર નંબરો ૧૪/૨૦૨૦ તારીખ ૮મી એપ્રિલ ૨૦૨૦, પરિપત્ર નં. ૧७/૨૦૨૦ તારીખ ૧૩મી એપ્રિલ, ૨૦૨૦, ૨૦/૨૦૨૦ Division under Nadiad Circle. 2). Tender ID No. 607478 for Repairing failed distribution transformers of various rating at In-house Transformer repairing Centre at Dabhan under તારીખ પમી મે, ૨૦૨૦, ૦૨/૨૦૨૧ તારીખ ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૧, ૧૯/૨૦૨૧ તારીખ ૮મી કિસેમ્બર, ૨૦૨૧, ૨૧/૨૦૨૧ તારીખ ૧૪મી કિસેમ્બર, ૨૦૨૧, ૨/૨૦૨૨ તારીખ ૫મી મે, ૨૦૨૨, Nadiad O&M Circle. 3). Tender ID No. 607584 for Misc. Civil Work and Construction of protection wall at RSO NadiadDabhan under Nadiad O&M Division under Nadiad Circle. ૧૦/૨૦૨૨ તારીખ ૨૮મી કિસેમ્બર ૨૦૨૨ અને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા 'સેબી'') દ્વારા જારી સામાન્ય પરિપત્ર નંબર SEBI/HÖ/CFD/CMD2/CIR/P/2022/62 તારીખ ૧૩મી download) & GUVNL/MGVCL websites www.mgvcl.com / https://tender.guvnl.com/index. , ૨૦૨૨ અને SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 તારીખ પમી જાન્યુઆરી, ૨૦૨૩ (સામુહિક રીતે પરિપત્રો) અને મીટિંગની નોટિસમાં દર્શાવ્યા મુજબ ના વિષયો/ મુદ્દાઓ માટે ભારત સરકાર ના Superintending Engineer, (O&M), MGVCL, C.O, Nadiad એમસીએ અને સેબી દ્વારા જારી કરાયેલા અન્ય તમામ લાગુ કાયદા અને પરિપત્રો અનુસાર, વિડિઓ કોન્ફરેન્સિંગ (''વીસી'')/ અન્ય ઓડિયો વિઝ્યુઅલ માધ્યમોં (''ઓએવીએમ'') દ્વારા ચોજવામાં આવશે.

> ઉકત પરિપત્રો અનુસાર, ૩૮મી એજીએમની નોટિસ સાથે વાર્ષિક અहેવાલ ૨૦૨૨–૨૩ ની ઇલેકટ્રોનિક કોપીઓ, જેમના ઇ–મેઇલ સરનામાં કંપની/ કિપોઝિટરી સહભાગી(ઓ) પાસે **શુક્રવાર, ૦૪થી ઓગસ્ટ,** ૨૦૨૩ ના રોજ નોંધાયેલા છે તે બઘા શેરધારકોને, મોકલી અપાઇ છે. તેની નકલ કંપનીની વેબસાઇટ એટલે કે www.munjalauto.com પર અને શેરબજારની વેબસાઇટ, www.bseindia.com અને <u>www.nseindia.com</u> પર પ્રાપ્ય છે. ૩૮મા વાર્ષિક અ**ફેવાલની ઇલેકટ્રોનિક કોપીઓ એ**જીએ ની નોટિસ સાથે, **શુક્રવાર, ૧૧મી ઓગસ્ટ, ૨૦૨૩** ના રોજ શેરધારકોને મોકલવામાં આવી છે.

> **કટ-ઓફ તારીખ. શનિવાર. ૨૬મી ઓગસ્ટ. ૨૦૨૩** ના રોજ ભૌતિક સ્વરૂપ અથવા ડીમટીરીચલાઇઝડ સ્વરૂપમાં શેર ધરાવતા શેરધારકોને, સી.ડી.એસ.એલ ની ઇલેકટ્રોનિક વોટિંગ સિસ્ટમ દ્વારા ૩૮મી એજીએમની નોટિસમાં દર્શાવ્યા મુજબના વિષયો/મુદ્દાઓ પર ઇલેકટ્રોનિક પધ્ધતિથી પોતાનો મત આપી

> **ઇ-મતદાનઃ** રિમોટ ઇ–મતદાન, **બુધવાર, ૩૦મી ઓગસ્ટ, ૨૦૨૩** ના રોજ ભારતીય સમય અનુસાર સવારે ૯:00 વાગ્યા થી પ્રારંભ થશે અને શ્ક્રવાર, ૦૧લી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ સાંજે પઃ૦૦ વાગ્યે સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન, કંપનીના સભ્યો, એજીએમ નોટિસમાં ઉલ્લેખિત વિષયો મુદ્દાઓ પર ઇલેક્ટ્રોનિક રીતે તેમના મત આપી શકે છે. રિમોટ ઇ-મતદાન શુક્રવાર, ૧લી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ ભારતીય સમય મુજબ સાંજે પઃ૦૦ વાગ્યા પછી નિષ્ક્રિય કરવામાં આવશે.

> જો કોઇ વ્યક્તિ એજીએમ નોટિસ મોકલ્યા પછી, પરંતુ ઇ-મતદાન માટેની કટ-ઓફ તારીખ એટલે કે **શનિવાર, ૨૬મી ઓગસ્ટ, ૨૦૨૩** અથવા કે તે પહેલા કંપનીનો સભ્ય બન્યો હોય તો આવી વ્યક્તિ કંપનીના ઇ-મેઇલ cs@munjalauto.com પર વિનંતી કરી, તેમના યુઝર આઇડ અને પાસવર્ડ મેળવી શકે છે.

શેરધારકો નોંધ લે કે :

- (અ) મતદાનની સુવિધા ૩૮મી એજીએમ દરમિયાન પણ ઉપલબ્ધ કરાશે અને વીસી/ઓએવીએમ દ્વારા ૩૮મી એજીએમમાં હાજર રહેલા શેરધારકો, કે જેમણે રિમોટ ઇ–મતદાન વિષયો/મુદ્દાઓ પર તેમના મત આપ્યા નિ હોય અથવા ઇ-મતદાન કરવા પર તેમને પ્રતિબંધિત કર્યા નહિ હોય, તેઓ ૩૮મી એજીએમમાં ઇ-મતદાન માધ્યમથી એજીએમ દરમિયાન મત આપવા પાત્ર
- બ) ૩૮મી એજીએમ પૂર્વે રિમોટ ઇ–મતદાનથી જેમણે મત આપ્યા હોય તેવા શેરધારક સભ્ય ૩૮મી એજીએમમાં હાજરી આપી શકે છે. પરંતુ તેમના મત ફરીથી આપવા માટે તેઓ પાત્ર રહેશે નહિ
- s) કટ–ઓફ તારીખ ના રોજ ડિપોઝિટરીઓ દ્વારા જાળવવામાં આવેલા રજીસ્ટ ઓફ મેમ્બર્સ અથવ રજીસ્ટર ઓફ બેનીફીશિયલ ઓનર્સમા નોંધાયેલ હોય તેવી વ્યક્તિઓ જ ૩૮મી એજીએમ માટે રિમોટ ઇ-મતદાન અથવા ઇ-મતદાનની સુવિધા નો લાભ લેવા માટે હકદાર રહેશે.

શેરધારકોના શેર ડીમટીરીચલાઇઝડ માધ્યમ, ભૌતિક માધ્યમમાં અથવા એવા શેરધારકો કે જેમન ઇ–મેઇલ સરનામાં નોંધાયા ના હોય તેવા શેરધારકો માટે રિમોટ ઇ–મતદાનની પધ્ધતિ ૩૮મી એજીએમની નોટસિમાં આપવામાં આવી છે. આ વિગતો કંપનીની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ રહેશે. સભ્યોને આવી વિગતો પ્રાપ્ત કરવા માટે <u>www.munjalauto.com</u> ની મુલાકાત લેવા વિનંતી છે.

બુક કલોઝરઃ ધી કંપનીઝ એકટ, ૨૦૧૩ ના સેકશન ૯૧ અને તેને અંતર્ગત નિયમોને સાથે વંચાણમ લેતા તેમજ લિસ્ટિંગ રેગ્યુલેશન ના રેગ્યુલેશન ૪૨ ના અન્વચે કંપનીના રજીસ્ટર ઓફ શેરહોલ્કર્સ અને શેરટ્રાન્સફર ૨જીસ્ટર, ૩૮મી વાર્ષિક સાધારણ સભાના હેતુથી, **રવિવાર, ૨૭મી ઓગસ્ટ, ૨૦૨૩ થી શનિવાર, ૦૨જી સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધી** (બંને દિવસ સંહિત) બંધ રહેશે.

શેરધારકો, જેમણે તેમના ઇમેઇલ સરનામાં રજીસ્ટર/અપડેટ કર્યા નથી તેઓને નીચે દર્શાવેલ પગલાઓનું પાલન કરવા વિનંતી.

(૧) ભૌતિક સ્વરૂપમાં શેર ધરાવનારા શેરધારકોને નીચેના સરનામે સંબંધિત દસ્તાવેજો સાથે રજીસ્ટ્રાર એન્ડ શેર ટ્રાન્સફર એજન્ટ્સ (આર.ટી.એ.) ને ફોર્મ ISR-1 ની ભૌતિક નકલ જમા કરીને તેમના ઈમેઇલ સરનામાની નોંધણી/ અપડેટ કરવા વિનંતી કરવામાં આવે છે.

એમ.સી.એસ શેર ટ્રાન્સફર એજન્ટ્સ લિમિટેડ, (યુનિટ મુંજાલ ઓટો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ)

પહેલો માળ, નીલમ એપાર્ટમેન્ટ, ૮૮, સંપતરાવ કોલોની, છપ્પનભોગ સ્વીટ ઉપર, અલકાપુરી, વડોદરા– ૩૯૦૦૦૭. ઇમેઇલઃ mcsltdbaroda@gmail.com, ટેલીફોનઃ (૦૨૬૫) ૨૩૧૪७૫७, ૨૩૫૦૪૯૦, ફેક્સઃ (૦૨૬૫) ૨૩૪૧૬૩૯

ISR รัฟิส์ ใ นับ ให้ร https://munialauto.com/wp-content/uploads/2023/05/ISR-1.pdf ๘เลา

) ડીમટીરીચલાઇઝ્ડ માધ્યમમાં શેર ધરાવતા શેરધારકોએ પોતાના ડીપોઝીટરી સહભાગીઓ, કે જેમની પાસે તેઓ ડીમેટ એકાઉન્ટ ધરાવે છે તેમની સાથે પોતાના ઇમેઇલ સરનામાની નોંધણી/ અપડેટ કરવા વિનંતી કરવામાં આવે છે.

શેરધારકો નોંધ લે કે ૨૩ મી મે, ૨૦૨૩ ના રોજ યોજાયેલી બેઠકમાં બોર્ડ ઓફ ડીરેકટર્સે પ્રત્યેક રૂ. ૨/– ના ઇક્વિટી શેર પર રૂં. ૨/– પ્રતિ ઇક્વિટી શેર ના અંતિમ ડિવિડન્ડની ભલામણ નાણાંકીય વર્ષ ૨૦૨૨–૨૩ માટે કરી છે. જો આગામી એજીએમમાં શેરધારકો દ્વારા ડિવિડન્ડ મંજુર કરવામાં આવે તો, ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં ચૂકવવામાં આવશે. શેરધારકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ડિવિડન્ડ મેળવવા માટે પોતાની સંપૂર્ણ બેંક એકાઉન્ટ વિગતો સાથે તેમના ઇલેકટ્રોનિક ક્લિચરિંગ સર્વિસ (ઇ.સી.એસ.) આદેશને કંપનીના રજિસ્ટ્રાર અને

શેરટ્રાન્સફર એજન્ટ (એમ.સી.એસ.) સાથે અપડેટ/રજીસ્ટર કરે. બેજીએમ∕ ઇ–મતદાન સુવિધા સાથે જોડાચેલી તમામ ફરિચાદો ∕મુંઝવણ માટે સભ્યો **શ્રી રાકેશ દલવી, સીનીચર મેનેજર, ("સીડીએસએલ")** સેન્ટ્રલ કિપોઝિટરી સર્વિસીસ (ઇન્કિચા) લિમિટેડ એ વિંગ, ૨૫મો માળ, મેરેથોન ફ્યુચરેકસ, મફતલાલ મિલ કમ્પાઉન્ડ્સ, એન.એમ.જોશી માર્ગ લોઅર પરેલ (પૂર્વ), મુંબઇ- ૪૦૦૦૧૩ ને પૂછપરછ કરી શકે છે અથવા ઇ-મેઇલ આઇડી helpdesk.evoting@cdslindia.com પર અથવા ટોલ ફ્રી નંબરઃ ૧૮૦૦ ૨૨ ૫૫ ૩૩ પર સંપર્ક કરી શકે છે. અન્ય કોઇપણ પ્રશ્નો અથવા સમસ્યાઓના કિસ્સામાં, સભ્યો ઉપરોકત રિજસ્ટર્ડ ઓફીસ સરનામા પર અથવા <u>cs@munjalauto.com</u> પર લખી શકે છે.

મુંજાલ ઓટો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વતી રાકેશ જોહરી કંપની સેક્રેટરી

મ્યુનિસિપલ કમિશનર

Managing Director

[Vatsala Vasudeva] સ્થળ : વાઘોડીયા, વડોદરા

તારીખ : ઓગસ્ટ ૧૧, ૨૦૨૩ એસીએસ૧૯૧૫૩

દઢાલ ગામ પાસે ખાડીમાં ટેન્કરમાંથી કેમિકલ વેસ્ટ ઠાલવતા ત્રણ ઝડ્યાયા

અંકલેશ્વર તાલુકાના દઢાલ માર્ગ ની બાજુમાં આવેલ ખાડીમાં ટેક્રર માંથી કેમિકલ વેસ્ટ ઠાલવવાનું કૃત્ય પ્રકાશમાં આવ્યું હતું.ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેક્રેર સાથે ત્રણ ઇસમોની અટકાયત કરી હતી.જ્યારે જીપીસીબી દ્વારા વેસ્ટના નમૂના લઇ પૃથકરણ માટે મોકલવામાં આવ્યા હતાં.ઉપરાંત એફ એસ એલની મદદ પણ લેવામાં આવી હતી.પ્રાપ્ત પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભરૂચ એલસીબી ની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી,તે દરમિયાન પોલીસને દાઢલ થી પેપ્સી કંપની તરફ જતા માર્ગ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપ પાસેની ખાડીમાં ટેક્રર માંથી કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવી રહ્યો છે.જે ચોક્કસ બાતમીને આધારે પોલીસે રેડ કરતા ત્રણ ઈસમો જીવ સૃષ્ટિને નુકશાન કારક કેમિકલ વેસ્ટ ખાડીમાં ઠાલવતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.એલસીબી Date:11.08.2023 પોલીસની ટીમે ત્રણ ઈસમો યોગેન્દ્રસિંગ રાજેન્દ્રસિંગ રાજપૂત,ધ્રુવ મનોજ મીના બંને રહે નાગદા,મધ્યપ્રદેશ તેમજ અનિલ રામજીભાઈ વસાવા રહે શિનોર,વડોદરાના ઓ ની અટકાયત કરી હતી.અને પોલીસ પૂછપરછમાં આરોપીઓ એ આ કેમિકલ વેસ્ટ મનોજ મીના,રહે નાગદા મધ્ય પ્રદેશના કહેવાથી ઝઘડીયા જીઆઇડીસીના પ્લોટ નંબર ૩૯/૩ ખાતેની વી આર ઇન્ડસ્ટ્રીઝ માંથી

ભર્યું હોવાની કબૂલાત કરી હતી.પોલીસે આ ગુનાહિત કૃ ત્યની સઘન તપાસ અર્થે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ

દેડીયાપાડાનાં મોહબુડી ગામે પત્નીની હત્યા કરી આત્મહત્યામા ખપાવનાર પતિને આજીવન કેદ

સીતાબેન ને દીકરી મેલાબેન ને શાંત રાખવા માટે કહેલ તે બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થતા પતિ મગન વસાવા એ ગોહિલ નાઓએ ફરીયાદપક્ષે પુરાવાઓ ધ્યાનમાં રાખી પ તિ મગન વસાવા

રાજપીપળા,તા.૧૧ મગનભાઈ જાતરીયાભાઈ વસાવા રહે.સામોટ તા.દેડીયાપાડા તથા સીતાબેન બન્ને પતિ-પત્નિ હોય તા.૨૭/૦૬/૨૦૨૦ ના તેમની નાની દિકરી મેલાબેન ખુબ રડતી હોય જેથી પતિ મગન વસાવા એ પત્ની

મોહબુડી (ઉપલી) ગામની સીમમાં આવેલ આશનબાર વિસ્તારમાં આવેલા તેમના ખેતરમાં આવેલ કાચા ઘરમાં પત્ની સીતાબેનના ગળામાં દોરડા વડે ટુપો આપી મોત નિપ જાવી તેમણે આત્મહત્યા કરી છે તેવું સાબિત કરવા તેમની લાશના ગળે દોરડું બાંધી ઘરમાં મોભની વળી સાથે લાશ લટકાવી તથા કપડાં બદલી નાંખી પુરાવાનો નાશ કરી ગુનો કર્યો હોય આ કેસ નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ એન. આર.જોષીની કોર્ટમાં ચાલી જતાં જેમાં ફરીયાદી તર્ફે સરકારી વડીલ જીતેન્દ્રસિંહ જે.

ગુનેગાર

ઠેરવી આજીવન

કેદની સજા અને

′રૂ.૫૦૦૦/− નો

દંડની સજાનો

હુકમ કર્યો છે.

S.E. (O&M) Baroda

(Formerly Known as S. E. Power Limited) CIN: L40106GJ2010PLC091880

Tel.: +91 2667 251566, E-mail: cs@sepower.in, Website: www.sepower.in

Particulars

(before Tax, Exceptional and/or Extraordinary Items)

Net Profit for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)

Total Comprehensive Income for the period

and Other Comprehensive Income (after tax)]

Reserves excluding Revaluation Reserves

[Comprising Profit/(Loss) for the period (after tax)

(as per balance sheet of previous accounting Year)

Earnings per Share (of Rs. 10 each) (not annualised)

1) The key standalone financial information of the Company is as under

Particulars

Net Profit for the period after tax

Paid up Equity Share Capital (Face value of Rs. 10/- per share)

Revenue from operations

rofit before tax

Profit after tax

Revenue from operations

Net Profit for the period

GUJARAT INDUSTRIES POWER COMPANY LIMITED Regd. Office : P.O. Ranoli - 391350, Dist. Vadodara (Gujarat)
Tel. No.: (0265) 2232768, Fax No.: (0265) 2230029, Email ID : investors@gipcl.com Website: www.gipcl.com, CIN: L99999GJ1985PLC007868

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30[™] JUNE 2023

dl.: ११-0८-२0२3

					[KS. IN LAKNS]
	Sr. No.	Particulars	Quarter ended 30.06.2023 Unaudited	Year ended 31.03.2023 Audited	Corresponding Quarter ended 30.06.2022 Unaudited
I	1	Total Income from Operations	36,021.42	140,368.95	30,882.14
	2	Net Profit for the period (before Tax, Exceptional and Extraordinary Items)	7,298.64	25,343.43	8,144.51
I	3	Exceptional Items	-	-	-
	4	Net Profit for the period before Tax (after Exceptional and Extraordinary Items)	7298.64	25,343.43	8,144.51
	5	Net Profit for the period after Tax (after Exceptional and Extraordinary Items)	5,737.36	18,869.37	6,285.75
I	6	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after Tax) and other Comprehensive Income (after tax)]	6,729.94	14,770.06	3,829.49
I	7	Equity Share Capital (Face Value of Rs. 10/- each)	15,125.12	15,125.12	15,125.12
I	8	Other Equity	-	300,304.58	-
	9	Earnings per Share (of Rs. 10/- each) for continuing and discontinued operations (not annualised) a) Basic (Rs.) b) Diluted (Rs.)	3.79	12.48	4.16
П	1 1	LDT DITUIEU (NS.)	2.70	12 /0	1 16

Notes: The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended. The full format of the Standalone Unaudited Financial Results are available on websites of Stock Exchanges viz. www.bseindia.com and www.nseindia.com and on Company's website (www.gipcl.com).

The above Unaudited Financial Results have been reviewed and recommended by the Audit Committee in its Meeting held on 9th August 2023 and subsequently approved by the Board of Directors in its Meeting held on 10th August 2023. The Company has designated an exclusive e-mail ID viz. investors@gipcl.com for investor grievance redressa

For Guiarat Industries Power Company Limited

Place : Gandhinagar

Quarter Ended

(Audited)

1620.40

(87.31)

(87.31)

(65.45)

4061.00

(0.16)

Quarter Ended

(Audited)

1620.40

(86.64)

(64.86)

30.06.2023 31.03.2023

30.06.2023 31.03.2023

(Unaudited

1751.82

(130.70)

(130.70)

(97.90)

4061.00

(0.24)

(Unaudited)

1751.82

(130.43)

(97.60)

The above is an extract of the detailed Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results

(Consolidated/Standalone) are available on the website i.e. www.sepower.in and on the Stock Exchanges' website

5774.17

(224.39)

(224.39)

(168.52)

(168.52)

4061.00

(3458.37)

(0.41)

Year Ended

31.03.2023

(Audited)

5774.17

(222.74)

(166.71)

પી.આર.ઓ.નંબર :૬૪૧/૨૩–૨૪

Date : 10th August 2023 SAMPANN UTPADAN INDIA LIMITED

30.06.2022

(Unaudited)

1378.25

(70.93)

(70.93)

4061.00

(0.13)

30.06.2022

Unaudited)

1378.25

(70.54)

(52.79)

વડોદરા મહાનગરપાલિકા

ભરતી અંગેની જાહેરાત

વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે સરકારશ્રીના ભરતી નિયમો અનુસાર ૧૦૦% ગ્રાન્ટ આધારિત નીચે જણાવેલ કેકરોની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઉભી થનાર જગ્યાઓ સીઘી ભરતીથી ભરવા માટે પસંદગી/પ્રતિક્ષા યાદી બનાવવાના हેતુસર નિયત લાયકાત ઘરાવતાં યોગ્ય ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે **www.vmc.gov.in** વેબસાઇટ પર **તા.૧૨–૦૮–૨૩ (૧૩.૦૦ કલાક) થી તા.૩૧–૦૮–૨૩ (૨૩.૫૯ કલાક)** સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.

	5H	જગ્યાનું નામ	કુલ જગ્યા	લિન ર	નનામત	અ.	ฑ.	અ.૧	۲ . ۳۱	સા.શૅ	.પ.વ.	આ.	я. ч .	કુલ જગ્યા પૈકી
١			•••	સામા	મહિ	સામા	મહિ	સામા	મહિ	સામા	મહિ	સામા	મહિ	શા.ખો.
ı				ન્ય	લા	ન્ય	લા	ન્ય	લા	ન્ય	લા	ન્ય	લા	ы
l	٩	મલ્ટી પરપઝ દેલ્થ વર્કર	39	16	06	01	-	०२	-	0.8	०१	09	-	06
	ર	ફીમેલ હેલ્થ વર્કર	зч	-	23	-	०२	-	०२	-	0.9	-	09	06

(૧) ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. (૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ઘોરણ તેમજ અન્ય માફિતિઓ વડોદરા મहાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે. (૩) ઉમેદવારે નિયત થયેલ ફી તા.૩૧-૦૮-૨૦૨૩ સુધીમાં માત્ર ઓનલાઇન ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ રદ ગણવામાં આવશે (૪) આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ઘ્યાને લઇ જે તે જગ્યાને અનુરૂપ એલીમીનેશન ટેસ્ટ/સ્પર્ધાત્મક પરીક્ષા/ઇન્ટરવ્યુ અંગે કમિશ્નરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે. (૫) ઉકત તમામ જગ્યાઓના મહેકમ ખર્ચની નાણાકીય જોગવાઇ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા થનાર છે તથા તે અનુસાર રાજય સરકારશ્રીને જરૂર જણાય તો ઉકત મહેકમને રાજ્ય સરકારમાં પ્રતિનિયુક્તિ પર લઇ શકશે. પ્રતિનિયુક્તિ પર આવેલ મહેકમને સરકાર રાજ્યના કોઇપણ સ્થળે ફરજ બજાવવા મૂકી શકશે. એટલેકે સદર તમામ જગ્યાઓ બદલીને પાત્ર છે તથા સરકારશ્રીને જરૂર જણાયે રાજ્યના કોઇપણ સ્થળે કરજ બજાવવા મુકી શકાશે/બદલી શકાશે.(૬) ઉપરોક્ત કેક્સેની ભવિષ્યમાં ખાલી પડનાર કે ગ્રાન્ટ આધારિત નવી ઉભી થનાર જગ્યાની ભરતી પ્રક્રિયા ઉપલબ્ધ પસંદગી યાદી/પ્રતિક્ષા યાદી પૈકી રોસ્ટર ક્રમની જાળવણી કરીને કરવામાં આવશે. (૭) ઉકત તમામ જગ્યાઓની મંજુરી રાજ્ય સરકારશ્રી દ્વારા નાંણાકીય વર્ષના અંત સુધી ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવેલ છે. ત્યારબાદ જગ્યાઓની મુદત વખતોવખતની રાજય સરકારશ્રીની મંજુરીને આધિન રહેશે. સદેર બાબતે વડોદરા મહાનગરપાલિકાની જવાબદારી નકકી થશે નહી.

નોંધઃ- ઉપરોક્ત જગ્યાઓ માટે સરકારશ્રીના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંકઃખરચ/૨૦૦૨ ૫૭ઝ-૧, તા.૧૬-૦૨-૨૦૦૬ અન્વચે ધોરણથી નિયમોનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.

For and on behalf of Board of Directors

Maintenance of HT/LT and Transformer center For ALL SCHEME WORK UNDER TEJGADH (O&M) S/DN or Any S/Dn of BODELI O&M Division (5) Tender ID 606823 Works Advertised Tender for Erection, Dismantling and Maintenance of HT/LT and Transformer center For ALL SCHEME WORK UNDER CHHOTAUDEPUR (O&M) S/DN or Any S/Dn of BODELI O&M Division (6) Tender ID 606825 Works Advertised Tender for Erection, Dismantling and Maintenance of HT/LT and Transformer center For ALL SCHEME WORK UNDER KAWANT(O&M) S/DN or Any S/Dn of BODELI O&M Division (7) Tender ID 606826 - Works Advertised Tender for Erection. Dismantling and Maintenance of HT/LT and Transformer center For ALL SCHEME WORK UNDER NASWADI(O&M) S/DN or Any S Dn of BODELI O&M Division (8) Tender ID 606828 - Works Advertised Tender for Erection, Dismantling and Maintenance of HT/L and Transformer center For RE WORKS UNDER BODELI(RE) S/DN FOR BODELI AG TASP/SPA OR Any S/Dn of BODELI O&N Division (9) Tender ID 606829 - Works Advertised Tender for Erection, Dismantling and Maintenance of HT/LT and Transformer cente

For RE WORKS UNDER BODELI(RE) S/DN FOR PAVIJETPUR AG TASP OR Any S/Dn of BODELI Division (10) Tender ID 606831 - Works Advertised Tender for Erection, Dismantling and Maintenance of HT/LT and Transformer center For RE WORKS UNDEF CHHOTAUDEPUR(RE) S/DN FOR TEJGADH AG TASP OR Any S/Dn of BODELI Division (11) Tender ID 606832 - Works Advertised Tender for Erection, Dismantling and Maintenance of HT/LT and Transformer center For RE WORKS UNDER CHHOTAUDEPUR(RE S/DN FOR C'Udepur AG TASP OR Any S/Dn of BODELI Division (12) Tender ID 606833 - Works Advertised Tender for Erection Dismantling and Maintenance of HT/LT and Transformer center For RE WORKS UNDER KAWANT(RE) S/DN FOR KAWANT AG TASP OR Any S/Dn of BODELLO&M Division (13) Tender ID 606834 Works Advertised Tender for Erection, Dismantling and

Maintenance of HT/LT and Transformer center For RE WORKS UNDER KAWANT(RE) S/DN FOR NASWADI AG TASP OR Any S Dn of BODELI O&M Division (14) Tender ID 602698 - Work Advertise Tender contract for repairing of failed distribution transformers of various rating at MGVCL In-house transformer repairing unit at Bodeli in the jurisdiction of Bodeli Division (15) Tender Notice No EE (O&M)/ BD /Aug-23/2 - Development and renovation of garden plots at different locations at Vidyut Nagar Colony Bungalows VIP GH and HO for the year 2023-24

PUBLIC NOTICE

THE COURT OF MOTOR ACCIDENT CLAIMS TRIBUNAL (MAIN) AT CHHOTAUDEPUR, GUJARAT, INDIA. (IN THE COURT OF PRINCIPAL AND SESSIONS JUDGE SHREE D. P. GOHIL SAHEB)

OPPONENT NO. 1/

Rajubhai Dungariyabhai Bhil Residing At :- Village Kosindra, Ta. Bodeli, Dist. Chhotaudepur informed

said applicants have filed these petitions against you, under sectio 166 of Motor Vehicle Act. 1939 for recovery of compensation. You are therefor hereby informed to remain present in person or by Legal Advocate in this Tribunal on 31/08/2023 at 11:00 AM without fail. You are hereby given this notice that if you will not remain present on the above said date, the matter will be heard and decide nand and seal of tribunal on thi

Verified By Prepared By sd/-Sr. Clerk Assistant (B.M. MAKWANA) BRAHMANIA) By Order

DY, Registrar
District Court, Chhotaudepur.
MACT, Branch.

Applicant Advocate: T. M. Rane NEXT DATE:- 31/08/2023 MACP No. 120/2021

Applicant :
Jayshaben @ Jayshreeben Lagin
@ Nagin Lachhubhai Rathva
D/O Morarjibhai Rathva
Residing at : Patel Faliya,
At. Salam Vat, Pipaladi,

The aforesaid opponents

10th day of August, 2023.

www.bseindia.com and www.nseindia.com Place : Vadodara

Notes:

(SACHIN AGARWAL)

(₹ in Lacs except EPS) Year Ended 31.03.2023 (Audited)

Regd. Off: Survey No. 54/B, Pratapnagar, Jarod-Savli Road, Samlaya, Vadodara-391520 (Guj.) EXTRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2023



VA TECH WABAG LIMITED

CIN: L45205TN1995PLC030231 Regd. office: "WABAG HOUSE", No.17, 200 Feet Thoraipakkam- Pallavaram Main Road, Sunnambu Kolathur, Chennai 600 117, Tamil Nadu, India. Tel: +91 44 6123 2323 | Fax : +91 44 6123 2324 Website: www.wabaq.com | E-mail: companysecretary@waba

EXTRACT OF STATEMENT OF CONSOLIDATED FINANCIAL RESULTS	1
(UN-AUDITED) FOR THE QUARTER ENDED JUNE 30, 2023	ı
/B 84:11: \	٦.

		(Rs. In Million)	
	Quarte	Quarter Ended		
Particulars	30.06.2023	30.06.2022	31.03.2023	
	Un-audited	Un-audited	Audited	
Total income from operations (net)	5,785	6,649	30,141	
Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items)	640	472	3,061	
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	640	392	169	
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	496	300	110	
Net Profit / (Loss) after taxes, minority interest and share of profit / (Loss) of associates	500	303	130	
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	489	268	328	
Equity Share Capital	124	124	124	
(Earnings per share before exceptional items (of Rs.2/-	each) (for continue	d and discontinued	operations) (in Rs.)	
Basic / Diluted	8.04	5.83	36.87	
(Earnings per share after exceptional items (of Rs.2/- ea			, , ,	
Basic / Diluted	8.04	4.85	2.07	

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites www.bseindia.com and also on the company's website www.wabag.com.

The above results were reviewed by the Audit Committee and approved and taken on record by the Board at its meeting held on 11.08.2023 and a limited review has been carried out by the Statutory auditors of the Company.

Figures for the previous periods have been regrouped/reclassified to confirm to the figure oresented in the current period.

The details of turnover, profit before tax and profit after tax on a standalone basis are

given below:		(Rs. In Million)		
	Quarter	Quarter Ended			
Particulars	30.06.2023	30.06.2022	31.03.2023		
	Un-audited	Un-audited	Audited		
Turnover	5,092	4,849	23,253		
Profit / (Loss) Before Tax (Before exceptional)	606	419	2,913		
Profit / (Loss) Before Tax (After exceptional)	606	339	21		
Profit / (Loss) After Tax	470	255	13		

For VA TECH WABAG LIMITED

Rajiv Mittal Chairman & Managing Director DIN : 01299110 Date: 11.08.2023

Super Spinning Mills Limited

CIN:L17111TZ1962PLC001200

Read. Office: "Elai Towers".P.B.No.7113.737-D.Green Fields. Puliakulam Road Coimbatore - 641045 Telephone No.: 0422-2311711 Fax No.: 0422-2311611 E-mail ld: investors@ssh.saraelgi.com Website: www.superspinning.com

Extract of Unaudited Financial Results for the Quarter ended June 30, 2023 under Ind AS

				Rs. in Lakns
	Particulars	3 months ended June 30, 2023 (Unaudited)	3 months ended June 30, 2022 (Unaudited)	Year to date figures March 31, 2023 (audited)
1	Total Income from Operations	991.34	2,545.94	8,571.86
3	Net Profit/ (Loss) for the period (before tax and exceptional items) Net Profit/ (Loss) for the period before tax	(360.97)	(214.34)	(1,321.69)
4	(after exceptional items and profit/loss from discontinued operations) Net Profit/ (Loss) for the period after tax	(122.32)	(214.34)	(1,810.37)
5	(after exceptional items and profit/loss from discontinued operations) Other comprehensive income (net of tax)	(122.32)	(214.34)	(1,956.38)
6 7 8 9	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] Equity Share Capital (face value of Rs.1 per share) Reserves (excluding Revaluation Reserve) Earnings Per Share (of Rs.1/- each) (for continuing	(122.32) 550.00	(214.34) 550.00	(1,956.38) 550.00
	and discontinued operations) a. Basic b. Diluted	(0.22) (0.22)	(0.08) (0.08)	(3.56) (3.56)

Note

The above financial results for the quarter ended June, 30, 2023 as reviewed and recommended by the Audit committee of the Board, has been approved by the Board of Directors at its meeting held or August 11, 2023. The above results are subjected to limited review by the statutory auditor of the Company. The report of statutory auditor is unqualified.

These financial results have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 read with relevant Rules thereunder and in terms of Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and SEBI circular dated July 5, 2016.

The above is an extract of the detailed format of the Quarterly Financial results for the quarter ended June 30, 2023 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Obligations Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results for the Quarte ended June 30, 2023 are available on the website of the BSE Limited and National Stock Exchange Limited i.e. www.bseindia.com and www.nseindia.com. the Stock Exchanges where the Company' shares are listed and on the website of the Company i.e., www.superspinning.com

To facilitate comparison, figures of the previous year / quarter have been rearranged/regrouped/recas

Place: Coimbatore Date: August 11, 2023

For Super Spinning Mills Limited Sumanth Ramamurthi Chairman and Managing Director



Regd. Office: Block Number 355, Manjusar Kunpad Road, Manjusar Village, Taluka Savli, Vadodara 391775, Gujarat. CHEMCON Email: investor.relations@cscpl.com | Website: www.cscpl.com | Tel: +91 265 2981195 | CIN: L24231GJ1988PLC011652

					(Rs. in Lacs)
	Particulars	Qı	arter Ende	ed	Year Ended
		30-06-2023	31-03-2023	30-06-2022	31-03-2023
		(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)
Ι	Total income from operations	8,291.43	8,196.84	9,209.32	31,619.94
Ш	Net Profit/(Loss) for the period	800.25	1,420.72	3,414.49	7,415.14
	(before Tax, Exceptional and/or Extraordinary items)				
Ш	Net Profit/(Loss) for the period before tax	800.25	1,420.72	3,414.49	7,415.14
	(after Exceptional and/or Extraordinary items)				
IV	Net Profit/(Loss) for the period after tax	590.83	1,047.01	2,545.77	5,511.01
	(after Exceptional and/or Extraordinary items)				
٧	Total Comprehensive Income for the period	583.81	1,035.95	2,543.70	5,482.92
	[comprising Profit/(Loss) for the period (after tax)				
	and Other Comprehensive Income (after tax)]				
VI	Equity Share Capital	3,663.07	3,663.07	3,663.07	3,663.07
VII	Other Equity	-	-	-	42,072.84
VIII	Earning Per equity Share (FV Γ 10/- Per share)	1.61	2.86	6.95	15.04
	basic & Diluted (in Γ)*				

EXTRACT OF STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2023

EPS as presented above is not annualised except for the year ended March 31, 2023

. The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the Company's website at www.cscpl.com and the Stock Exchange's Website at www.bseindia.com and www.nseindia.com.

> By order of the Board For Chemcon Speciality Chemicals Limited

Kamalkumar Rajendra Aggarwal Chairman & Managing Director DIN: 00139199

ASHV FINANCE LIMITED

Ashv

CIN: U65910MH1998PLC333546

14 Capital Redemption Reserve

16. Debt Service Coverage Ratio

15. Debenture Redemption Reserve

17. Interest Service Coverage Ratio

Place: Vadodara

Pate: August 11, 2023

AAVISHKAAR GROUF Read. Office & Corp. Office: 12B, 3rd Floor, Techniplex-II IT Park, Off. Veer Savarkar Flyover, Goregaon (West), Mumbai - 400 062, Maharashtra, India; Tel: +91-22-6249 2700, Fax: +91-22-6249 2787 Email: compliance.team@ashvfinance.com, Website: www.ashvfinance.com

UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30 JUNE 2023

(All amounts are in ₹ Lakhs, except for details of EPS and ration **PARTICULARS** 31 March 30 June 31 March 2023 Unaudited 2023 Audited 2023 Audited 2022 Total Income from Operations 4.707.93 6.828.9 4.246.85 22.084.8 Net Profit for the period (before Tax, (1,319.95) (1.477.30)1.231.74 170.31 Exceptional and/or Extraordinary items) Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items (1.477.30) 1.231.74 (1.319.95 170.31 Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items) (1.280.74)1.764.80 (1,409.51) 607.15 Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)] (1.280.74)1.770.56 (1,409.51)612.91 Paid up share capita 4.962.78 4.962.78 4.962.78 Reserves (excluding Revaluation Reserve and Security premium) (1.275.44)(6.70)(698 88 (6.70)Securities Premium Account 28.981.85 28.981.85 21.992.25 28.981.8 33.937.93 24.111.67 33.937.93 32.669.19 Net worth 10. Paid up Debt Capital / Outstanding Debt 0.30 0.32 0.32 0.32 11. Outstanding redeemable preference shares Not Applicable Not Applicable Not Applicabl lot Applicabl 12. Debt equity ratio 2.23 3.01 2.39 2.23 13. Earnings Per Share (EPS) Earnings Per Share (EPS) (Face value of Rs. 10 each) (not annualized for the quarter) (a) Basic (₹) (3.11)429 (4.19)1.48 (b) Diluted (₹) (3.11)3.55 (4.19)1.22

Note The above financial results were reviewed by the Audit and Compliance Committee and approved by the Board of Directors at their meeting held on 11 August 2023 and are reviewed by the Statutory Auditors

Not Applicable

Not Applicable

Not Applicable

Not Applicable

Not Applicable | Not Applicable | Not Applicable | Not Applicable

Not Applicable Not Applicable

Not Applicable Not Applicable

Not Applicable Not Applicable

Not Applicable Not Applicable

The financial results of the Company have been prepared in accordance with Indian Accounting Standards ("Ind AS") notified under Section 133 of the Companies Act 2013 ("the Act") read with the Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended from time to time and in accordance with the requirement of Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, as amended

The Board of Directors of the Company ("Company" or "Transferee Company") in their meeting held on 22 July 2020, had approved the Scheme of Arrangement (the 'Scheme') with TribeTech Private Limited ("TribeTech" or Transferor Company") and their respective shareholders for the demerger of the demerged undertaking of Transferor Company under Sections 230 to 232 and other applicable provisions of the Companies Act, 2013, the Companies (Compromises, Arrangements and Amalgamations) Rules, 2016 and other rules and regulations framed thereunder.

The Company has received requisite approvals and the scheme has been sanctioned by the Hon'ble National Company Law Tribunal (NCLT), Mumbai Bench vide its order dated 12 January 2023 with the Appointed Date of 1 April 2022, and accordingly, the books of account and financial results effecting the Scheme have been prepared with effect from 1 April 2022.

Figures of the quarter ended 30 June 2022 have been restated to include the effect of TribeTech Demerger The amounts of quarter ended 31 March 2023 are the balancing amounts between the restated amounts for the nine months ended 31 December 2022 and the audited amounts for the financial year ended 31

The above is an extract of the detailed format of quarterly financial results filed with the BSE Limited under Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly financial results are available on the websites of the BSE Limited i.e. www.bseindia.com and the Company i.e. www.ashvfinance.com

For the items referred in the Regulation 52 (4) of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures have been made to the BSE Limited and can be accessed or the website of the Company i.e. www.ashyfinance.com.

There were no exceptional/extraordinary items.

Date: 11 August 2023

Ashv Finance Limited Sd/-Nikesh Kumar Sinha **Managing Director** DIN: 08268336

DIN - 00002773 Place: Mumbai

Regd. Office: "Deccan Chambers", 6-3-666/B, Somajiguda, Hyderabad - 500082 Ph: 040-23310168 Fax: 040-23318366 Email: info@deccancements.com Website: www.deccancements.com

Extract of the Unaudited Financial Results for the Quarter ended 30 June 2023

DECCAN CEMENTS LIMITED CIN: L26942TG1979PLC002500

	Quarter ended				
SI. No	Particulars	30.06.2023	31.03.2023	30.06.2022	Year Ended 31.03.2023
NO		Unaudited	Audited	Unaudited	Audited
1	Total income from Operations	19207.74	19594.06	19401.62	78154.48
2	Net Profit for the period (before Tax and Exceptional items)	1913.87	1337.69	2774.90	6661.08
3	Net Profit for the period before tax (after Exceptional items)	1913.87	1337.69	2774.90	6661.08
4	Net Profit for the period after tax (after Exceptional items)	1414.17	989.51	2067.78	4929.52
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1414.17	950.77	2067.78	4890.78
6	Paid-up Equity Share Capital	700.38	700.38	700.38	700.38
7	Earnings Per Share (Rs. 5/- each)				
	1. Basic :	10.10	7.06	14.76	35.19
	2. Diluted :	10.10	7.06	14.76	35.19

Notes

Place: Hyderabac

Date: August 11, 2023

- a) The above results for the quarter were reviewed by the Audit Committee and approved by the Board of Directors at the meeting held on 11th August, 2023.
- b) The above is an extract of the detailed format of financial results filed for the quarter ended 30 June 2023 with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the aforesaid results are available on the Stock Exchange Websites i.e. Bombay Stock Exchange (www.bseindia.com) and National Stock Exchange (www.nseindia.com) and also on the Company's website (www.deccancements.com).

for DECCAN CEMENTS LIMITED P Parvathi Chairperson and Managing Director

JANA SMALL FINANCE BANK

(A Scheduled Commercial Bank)
CIN No. U65923KA2006PILC040028
Office: The Fairway Business Park #10/11/12/12/2B, Off Domlur, tala Inner Ring Road, Next to EGL, Challaghatta, Bengaluru 560

			(₹ in 000s)
	Quarte	r ended	Year ended
Particulars	30-06-2023 (Audited)	30-06-2022 (Audited)	31-03-2023 (Audited)
Total Income from Operations	1,07,29,902	85,65,861	3,69,98,750
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	9,03,649	4,51,138	25,59,713
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	9,03,649	4,51,138	25,59,713
Net Profit / (Loss) for the year (after tax) (after exceptional and/or Extraordinary items)	9,03,649	4,51,138	25,59,713
Paid up Equity Share Capital	6,98,293	5,25,363	5,49,787
Reserves (excluding Revaluation Reserve)	1,99,32,822	1,11,82,737	1,47,22,765
Networth (Tier I Capital)	2,33,48,722	1,25,52,922	1,70,74,801
Paid up Debt Capital / Outstanding Debt	5,96,34,900	5,65,09,254	6,27,74,600
Outstanding Redeemable Preference Shares	Nil	Nil	Nil
Capital Adequacy Ratio (%)	18.67%	15.13%	15.57%
Debt Equity Ratio	2.55	4.50	3.68
Earnings Per Equity Share (face value of ₹ 10 per share)			
1. Basic (₹)	16.20	8.76	47.47
2. Diluted (₹)	14.09	8.14	42.64

- The above results of the Bank have been reviewed and recomme the Board of Directors at their meeting held on August 11, 2023.

For and on behalf of the Board of Directors Ajay Kanwal Managing Director & Chief Executive Officer Place: Mumbai

ONE POINT ONE SOLUTIONS LIMITED POINT

EXTRACT OF AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30th JUNE. 2023

Ι.		The meaning over						
	Sr.			Quarter ended				
	No.	Particulars	30.06.2023 (Unaudited)	31.03.2023 (Audited)	30.06.2022 (Unaudited)	31.03.2023 (Audited)		
	1. 2.	Total Income from Operations Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or	4,024.35	3,872.18	3,505.41	14,423.98		
	3.	Extraordinary items) Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or	608.63	475.22	242.27	1,282.16		
	4.	Extraordinary items) Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or	608.63	475.22	242.27	1,282.16		
	5.	Extraordinary items) Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss)	432.16	295.28	178.84	878.96		
		for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	428.02	290.06	179.32	856.12		
	6. 7.	Equity Share Capital Reserves (excluding Revaluation Reserve)	3,908.77	3,761.19	3,761.19	3,761.19 1,758.72		
	8.	Earnings Per Share (of Rs. 2/- each) Basic:	0.22	0.16	0.10	0.47		
		Diluted:	0.22	0.16	0.10	0.47		

EXTRACT OF AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2023:

			(Rs. In Lakhs e	xcept per snare data)
		Year ended		
Particulars	30.06.2023 (Unaudited)	31.03.2023 (Audited)	30.06.2022 (Unaudited)	31.03.2023 (Audited)
Total Income from Operations Profit /(Loss) for the period (Before tax/ Exceptional and/or extraordinary Item) Profit/(Loss) (After tax/ Exceptional and/or extraordinary Item) Total Comprehensive income after tax	4,023.14 609.42 430.31 426.16	3,871.23 476.80 295.46 290.23	3,504.24 242.76 174.59 175.07	

The above results were reviewed by the Audit Committee & approved by the Board of Directors in its meeting dated 11th August, 2023. The above is an extract of detailed format of financial results filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosures Regulations, 2015. The full format of financial results is available on the website of National Stock Exchange of Intimited and the Company.

Akshay Chhabr Chairman and Managing Directo



GINNI FILAMENTS LIMITED CIN: L71200UP1982PLC012550 Regd. Office: 110 K.M. Stone, Delhi-Mathura Road, Chhata-281401 Distt. Mathura (U.P.)

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS

FOR THE QUARTER ENDED JUNE 30, 2023

(₹ in Lacs except per Share data Particulars Quarter ended Quarter ended Year ended 30.06.2022 31.03.2023 30.06.2023 Unaudited Unaudited Audite 27.485.29 Total Income from Operations (net) 22,455,74 95.317.2 Net Profit / (loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items) (1,325.67) 323.96 (2,573.16 (1,325.67 323.96 (2,573.16 Net Profit / (loss) for the period before tax (after Exceptional and/o xtraordinary items) Net Profit / (loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) (883.20 215.94 (1.433.08 (885.31 212.24 (1,381.93) Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)] Paid up Equity Share Capital(Face Value of ₹ 10/- each) 8.565.0 8.565.01 8 565 0 Other Equity 19,323.98 Earnings Per Share (of ₹ 10/- each) (not annualised) a) Basic (1.03) 0.25 (1.67) (1.03) 0.25 (1.67 b) Diluted:

accepted in India.

Place : Noida

The above results have been reviewed by the Audit Committee and subsequently approved by the Board of Directors at its meeting held or August 11, 2023. The Statutory Auditors have carried out limited review for the quarter ended June 30, 2023.

The above is an extract of the detailed format of the financial results for the quarter ended June 30, 2023 filed with the Stock Exchanges unde Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results ar available on the Company's website (www.ginnifialments.com) and Stock Exchange website (www.nseindia.com).

The above results are in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended time to time and prescribe under Section 133 of the Companies Act, 2013, read with the relevant rules issued thereunder and other accounting principles generally

> For and on behalf of the Board of Directors GINNI FILAMENTS LIMITED

> > **CHAIRMAN & MANAGING DIRECTOR**

SHISHIR JAIPURIA

Date : August 11, 2023





STANDALONE FINANCIAL HIGHLIGHTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2023

(< in cror				
QUARTER ENDED				
30.06.2023	30.06.2022			
1162.99	1272.86			
128.63	182.97			
122.46	179.22			
92.16	155.38			
70.82	114.60			
101.12	138.44			
3.09	5.00			
	30.06.2023 1162.99 128.63 122.46 92.16 70.82 101.12			

Regd. Office: "AMBUJA TOWER", Opp. Sindhu Bhavan, Sindhu Bhavan Road, Bodakdev, P.O. Thaltej, Ahmedabad - 380 059. Ph.: +91 79 6155 6677, Fax: +91 79 6155 6678,

Email: info@ambujagroup.com Website: www.ambujagroup.com CIN: L15140GJ1991PLC016151 This is not a statutory release. For detailed statutory results, please visit www.ambujagroup.com

JTPM ATSALI LIMITED CIN: U27320MH2018PLC304905

Registered Office: Grand Palladium, 6" Floor, 175 CST Road, Kolivery Village, MMRDA Area, Santacruz East, Mumbai, Maharashtra, India, 400098. Contact no: 022-4286 6108; Email ID: csjtpmatsali@jsw.in; Website: www.Jtpmatsali.com

	STATEMENT OF STANDALONE UN-AUDITED FINANCIALS RESULTS FOR THE FIRST QUARTER ENDED JUNE 30, 2023		(Amount In except per	thousands, share data)
Sr. No.	Particulars	Quarter ended		Year ended
		30.06.2023 Unaudited	30.06.2022 Unaudited	31.03.2023 Audited
1	Total Income from Operations	-		6,351
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	(127,267)	(123,361)	(523,546)
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	(127,267)	(123,361)	(523,546)
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	(127,049)	(123,330)	(523,414)
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	44,029	(623,236)	(706,373)
6	Paid up Equity Share Capital	100	100	100
7	Reserves (excluding Revaluation Reserve)	(1,756,176)	(1,717,069)	(1,800,206)
8	Securities Premium Account	-	-	-
9	Net worth	(1,756,076)	(1,716,969)	(1,800,106)
10	Paid up Debt Capital / Outstanding Debt	3,238,733	3,237,168	3,237,763
11	Outstanding Redeemable Preference Shares (In Nos)	Nil	Nil	Nil
12	Debt Equity Ratio	N.A*	N.A*	N.A*
13	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) - (not annualised)			
	1. Basic:	(12,705)	(12,333)	(52,341)
	2. Diluted:	(12,705)	(12,333)	(52,341)
14	Capital Redemption Reserve	N.A	N.A	N.A
15	Debenture Redemption Reserve	-	-	-
16	Debt Service Coverage Ratio	(0.002)	(0.006)	(0.007)
17	Interest Service Coverage Ratio	(0.002)	(0.006)	(0.007)

* As the networth is negative, debt/equity ratio has not been computed

- The above results have been reviewed by the Audit Committee and approved by the Boad of Directors at their respective meetings held on August 11, 2023. The statutory auditors of the Company have carried out limited review of the above standalone financial results for the quarter
- The above is an extract of detailed format of the quarter and nine months ended financial results filed with BSE Limited under Regulation 52 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarter and nine months ended financial results are available on the on the website of BSE Limited viz. www.bseindia.com and on the Company's website www.jtpmatsali.com

For the items referred in Regulation 52 (4) of the SEBI (Listing Obligation and Other Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures have been made to the BSE Limited and can be accessed on the website viz. www.bseindia.com
Previous year / period figures have been reclassified/regrouped, wherever necessary to confirm the current periods classification

For JTPM Atsali Limited

Date: August 11, 2023 Bhushan Prasad